



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં એપ્રિલ 13 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો અને ગૂડ ફાઈડે સર્વિસ વિગતો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 7, 2020) – COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના સમુદાયને સુરક્ષિત રીતે સર્વિસ આપતી હોવાની ખાતરી કરાવવા, બસ સર્વિસમાં આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી નીચે જણાવ્યા પ્રમાણે ફેરફાર, સોમવાર એપ્રિલ 13 થી અમલમાં આવશે:

નીચે યાદીબદ્ધ રૂટ્સ નીચેના સમયપત્રકો પ્રમાણે ચાલશે:

- **સોમવારથી શનિવાર** – બસો વધારે સારી રવિવારની સર્વિસ (રવિવારની નિયમિત સર્વિસની સાથે સવારે અને બપોર પછીના વ્યસ્ત સમયે વ્યસ્ત રૂટ્સ પર વધારાની ટ્રિપ્સ, જેમાં વીકડેઝ માટે (કામકાજના દિવસોએ) નિયમિત ટ્રિપ સમયની જેમ અગાઉની ટ્રિપ્સ સામેલ છે)
- **રવિવાર** – બસો રવિવારની સર્વિસ માટે ચાલુ રહેશે, જેમાં કેટલાક રદ કરેલા (કેન્સલ્ડ) રૂટ્સ સામેલ છે
- 501 ઝુમ ક્વીન (હાઈવે 7 થી માત્ર વૉન મેટ્રોપોલિટન સેન્ટર સુધી)
- 502 ઝુમ મેઈન
- 511/511A ઝુમ સ્ટીલ્સ
- 1 ક્વીન
- 2 મેઈન
- 3/3A મેકલાઈલન
- 4/4A ચિંગકુસી
- 5 બોવાર્ડ
- 6 જેમ્સ પોર્ટર – માત્ર વ્યસ્ત સમયની સર્વિસ અને રવિવારે કોઈ સર્વિસ નહીં
- 7/7A કેનેડી
- 10 ઈન્ડસ્ટ્રીયલ – માત્ર સોમવાર-શુક્રવાર સર્વિસ
- 11/11A સ્ટીલ્સ
- 14/14A ટોરબ્રામ
- 15 બ્રેમલી
- 18 ડિક્સી
- 20 ઈસ્ટ ઈન્ડસ્ટ્રીયલ – માત્ર સોમવાર-શુક્રવાર સર્વિસ
- 23 સેન્ડલવૂડ
- 26 માઉન્ટ પ્લીઝન્ટ – સર્વિસ માત્ર સાંજે 7 વાગ્યા સુધી અને રવિવારે કોઈ સર્વિસ નહીં
- 29 વિલિયમ્સ પાર્કવે – માત્ર વ્યસ્ત સમયે સર્વિસ અને રવિવારે કોઈ સર્વિસ નહીં
- 30 એરપોર્ટ રોડ
- 31 મેકવીન – માત્ર વ્યસ્ત સમયે સર્વિસ અને રવિવારે કોઈ સર્વિસ નહીં
- 50 ગોર રોડ



- 51 હેરેફોર્ડ - માત્ર વ્યસ્ત સમયે સર્વિસ અને રવિવારે કોઈ સર્વિસ નહીં
- 53 રે લોસન (રવિવારે કોઈ સર્વિસ નહીં)
- 56 કિંગનોલ (રવિવારે કોઈ સર્વિસ નહીં)
- 60 મિસિસાગા રોડ – માત્ર સોમવાર-શુક્રવાર વ્યસ્ત સમયે સર્વિસ અને શનિવારે/રવિવારે કોઈ સર્વિસ નહીં
- 115 એરપોર્ટ એક્સપ્રેસ

રદ કરેલા રૂટ્સની યાદી માટે વેબસાઈટ www.bramptontransit.com જુઓ.

ઝુમ આર્ટિક્યુલેટેડ બસો વધારાની ક્ષમતા માટે અને ઉતારુઓ વચ્ચે શારીરિક અંતર રાખવાના આચરણોને ટેકો આપવા અન્ય રૂટ્સને ફાળવવામાં આવી શકે.

અમે ઉતારુઓ વચ્ચે શારીરિક અંતર રાખવાના આચરણોને ટેકો આપવા બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠક સુધી સીમિત કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કેટલાક બહુ વ્યસ્ત રૂટ્સ પર વધારાના સંસાધનોની ફાળવણી ફરીથી કરવાના હેતુસર આ ફેરફારો કરવામાં આવશે. લક્ષ્ય એ ખાતરી કરાવવાનું છે કે સંસાધનો છૂટ આપે તેટલી વધારેમાં વધારે સર્વિસ પૂરી પાડવી અને શહેરના તમામ વિસ્તારોને પબ્લિક ટ્રાન્ઝિટની વ્યાજબી પહોંચ પૂરી પાડવી.

ગૂડ ફ્રાઈડે સર્વિસ – એપ્રિલ 10

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ગૂડ ફ્રાઈડે માટે ઘટાડેલી રવિવાર/રજાના દિવસની સર્વિસની જેમ ચાલુ રહેશે. રદ કરેલા રૂટ્સ સહિત, ઘટાડેલી રવિવાર/રજાના દિવસની સર્વિસને લગતી વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે, www.bramptontransit.com.

સંપર્ક કેન્દ્ર ઉતારુઓને સહાયરૂપ થવા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી 905.874.2999 નંબર પર ચાલુ અને ઉપલબ્ધ રહેશે.

ટર્મિનલ્સ પર બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સગવડો અને કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ જાહેર જનતા માટે બંધ કરેલા છે.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજિંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અઘતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.



BRAMPTON

Service and Information Update

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अँड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाट

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca